

PROVISIONAL ANSWER KEY

NAME OF THE POST:1) Assistant Professor, Biomedical Engineering
(AOS-A,) (Advt. No. : 90/2015-16) Class II

(2) Assistant Professor, Automobile Engineering (APT)

Advt. No. : (93/2015-16)

DATE OF PRELIMINARY TEST : 18/03/2017

SUBJECT : General Studies (Que. 001 to 100)

Date of Publish : 27/03/2017

Last Date to send Suggestion(s) : 03-04-2017

Note : Candidate must ensure the compliance to send all
suggestion in the given

format with reference to this paper with provisional answer key
only. Any non

compliance shall not be treated.

001. આ જંગલમાં મોદડ, ગુગળ, ખાખરો, ટીમરુ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઈન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડાં વગેરે ઔષધિય વૃક્ષો આવેલા છે. આ જંગલ ગુજરાતના વિસ્તારમાં આવેલું છે.
 (A) અંબાજી (B) પંચમહાલ
 (C) વડોદરા (D) જુનાગઢ
002. રોઝીબેટ ક્યા જિલ્લામાં આવેલો છે?
 (A) ગીર સોમનાથ (B) જામનગર
 (C) પોરબંદર (D) કચ્છ
003. ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી ક્યા વર્ષથી સંકલિત વનવિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે?
 (A) ઈ. સ. 1987-88 (B) ઈ. સ. 1993-94
 (C) ઈ. સ. 1991-92 (D) ઈ. સ. 1996-97
004. માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર છે.
 (A) ઝુરા (B) ચોટીલા
 (C) વરાર (D) રતનાલ
005. સિપ્રી અને બાલારામ કઈ નદીની શાખા નદીઓ છે?
 (A) સરસ્વતી (B) રૂપેણ
 (C) બનાસ (D) અર્જુની
006. નાઈટ્રોજનયુક્ત ખાતરોના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે?
 (A) પ્રથમ (B) બીજો
 (C) ચોથો (D) પાંચમો
007. યાદી-1 ની સાથે યાદી-2 જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- | | યાદી-1 | યાદી-2 |
|-------|------------------------------------|----------|
| (I) | રિપ્રોડક્ટીવ બાયોલોજી રિસર્ચ યુનિટ | 1 જામનગર |
| (II) | મિલેટ રિસર્ચ સેન્ટર | 2 ધારી |
| (III) | પલ્સ રિસર્ચ સેન્ટર | 3 આણંદ |
| (IV) | ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર | 4 નવસારી |
- | | (I) | (II) | (III) | (IV) |
|-----|-----|------|-------|------|
| (A) | 3 | 2 | 1 | 4 |
| (B) | 4 | 3 | 1 | 2 |
| (C) | 1 | 3 | 2 | 4 |
| (D) | 3 | 1 | 4 | 2 |

008. “મશીરા” વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલ છે?
- (A) પઢાર (B) ડાંગી
(C) ધમાલ (D) ટીખણી
009. “બનીઠની” કઈ કળાની એક શૈલી છે?
- (A) ચિત્રકળા (B) શિલ્પકળા
(C) નૃત્યકળા (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં
010. ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ કઈ સંસ્થા આપે છે?
- (A) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (B) ગુજરાતી સાહિત્ય પરિષદ
(C) ગુજરાત સાહિત્ય સભા (D) ગુજરાતી સાહિત્ય અકાદમી
011. ગુજરાતની કઈ કળા વિશ્વની અદ્યત્ત વિરાસતોની યાદીમાં સામેલ છે?
- (A) સાડેલી આર્ટ વર્ક (Sadeli-Art-work)
(B) સંખેડા લાખ વર્ક (Sankheda Lac-work)
(C) બોડેલી વર્ક (Bodeli work)
(D) ઉપર પૈકી એકપણ નહીં.
012. કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કના મેનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે?
- (A) પ્રભાશંકર સોમપુરા (B) બાલકૃષ્ણ દોશી
(C) મધે ગુરૂજી (D) કાન્તિભાઈ પટેલ
013. નીચે દર્શાવેલ અ અને બ યાદીને જોડીને વિકલ્પ પસંદ કરો.
- | | અ | બ |
|-------|------------------|-----------------|
| (I) | મધુસૂદન ઢાંકી | 1 ચિત્રકલા |
| (II) | યશોધર મહેતા | 2 સાહિત્ય |
| (III) | કનુ દેસાઈ | 3 પુરાતત્ત્વવિદ |
| (IV) | ભગવાનલાલ ઈંદ્રજી | 4 સ્થાપત્ય |
- | | (I) | (II) | (III) | (IV) |
|-----|-----|------|-------|------|
| (A) | 3 | 4 | 2 | 1 |
| (B) | 4 | 2 | 1 | 3 |
| (C) | 4 | 1 | 2 | 3 |
| (D) | 3 | 2 | 1 | 4 |

014. નીચે પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી?
 (A) કડીયા ડુંગરની ગુફાઓ (B) જોગીડાની ગુફા
 (C) દેવની મોરી (D) ભુજિયો કોઠો
015. નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એકજ ભારતીય રાજ્યને સ્પર્શે છે?
 (A) ત્રિપુરા (B) મિઝોરમ
 (C) મેઘાલય (D) અરુણાચલ પ્રદેશ
016. કેરળમાં આવેલા અનાઈમુડી નામના પર્વતની શી વિશેષતા છે?
 (A) ત્યાં વધુ વરસાદ પડે છે.
 (B) તેની ઉપર ખૂબ સંખ્યામાં મંદિરો આવેલા છે.
 (C) તેમાં વધુ હિંસક પ્રાણીઓ વસે છે.
 (D) દક્ષિણ ભારતમાં આવેલા બધા પર્વતોમાં સૌથી ઊંચો પર્વત છે.
017. “ભૂખરી ક્રાંતિ” (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે?
 (A) પેટ્રોલિયમ (B) ખાતર
 (C) ચામડા નિર્મિત વસ્તુઓ (D) ઈંડા
018. 2011 ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે?
 (A) ગુજરાત (B) મહારાષ્ટ્ર
 (C) તમિલનાડુ (D) ગોવા
019. રાજસ્થાનની કઈ ભૌગોલિક વિશેષતા માટે ત્યાંની સ્થાનિક ભાષામાં “ધ્રિયાં” શબ્દ પ્રચલિત છે?
 (A) ચૂનાના પથ્થર (B) જિપ્સમ
 (C) રેતીના ઢૂવા (D) મીઠા પાણીના સરોવરો
020. “એટમ બોમ્બ” કયા ફળ/પાકની સંકર જાતિ છે?
 (A) નારંગી (B) મકાઈ
 (C) ચીકુ (D) જામફળ
021. નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે?
 (A) રાજસ્થાન (B) ઝારખંડ
 (C) મધ્યપ્રદેશ (D) ઉપરોક્ત એકપણ નહિ

022. નીચે દર્શાવેલ દેશ અને સરોવરને યોગ્ય રીતે જોડીને વિકલ્પ પસંદ કરો.

	સરોવર		દેશ
(I)	મૃત	1	કઝાકિસ્તાન
(II)	બૈકલ	2	ચીન
(III)	ટોંગકિંગ	3	જોર્ડન
(IV)	તોનલેસેપ	4	કંબોડિયા

	(I)	(II)	(III)	(IV)
(A)	3	1	2	4
(B)	2	4	1	3
(C)	1	2	4	3
(D)	3	2	1	4

023. નીચે દર્શાવેલ પ્રાણીઓ પૈકી કયું પ્રાણી ઠંડા પ્રદેશનું પ્રાણી નથી?

- (A) સેબલ (B) રેકુન
(C) હેરિંગ (D) કેરિબુ

024. નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે?

- (A) તુવાલુ (B) રીપબ્લિકન ઓફ માલદીવ
(C) મોનાકો (D) વેટીકન

025. એશિયાખંડની પૂર્વમાં શું આવેલ છે?

- (A) પેસિફિક મહાસાગર (B) હિંદી મહાસાગર
(C) આફ્રિકાખંડ (D) ભૂમધ્ય સમુદ્ર

026. કઈ સીમારેખા “રેડક્લિફ રેખા” કહેવાય છે?

- (A) ભારત તથા અફઘાનિસ્તાન (B) ભારત તથા ચીન
(C) ભારત તથા બાંગ્લાદેશ (D) ભારત તથા પાકિસ્તાન

027. એન્ટવર્પ બંદર કયા મહાસાગરમાં આવેલ છે?

- (A) પેસિફિક મહાસાગર (B) એટલાંટિક મહાસાગર
(C) હિંદ મહાસાગર (D) આર્કટિક મહાસાગર

028. વોશિંગ્ટન કયા નદીના કિનારે વસેલ છે?

- (A) આશ્નોલા (B) મિસિસિપી
(C) લેવીસ (D) પોટોમેક

029. કર્કવૃત્તને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે?
 (A) મહી નદી (B) મહા નદી
 (C) ચંબલ નદી (D) નર્મદા નદી
030. લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી?
 (A) વડાપ્રધાન (B) લોકસભાના સ્પીકર
 (C) વિરોધ પક્ષના નેતા (D) માનવસંશાધન પ્રધાન
031. રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે?
 (A) છ માસ (B) એક માસ
 (C) છ અઠવાડિયા (D) ત્રણ માસ
032. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પૈકી તમામ અથવા કોઈપણ સિદ્ધાંતોને કાર્યાન્વિત કરવાની રાજ્યની નીતિ અમલમાં મૂકતો કોઈ કાયદો, તેનાથી અનુચ્છેદ 14, 19 કે 31 નો ભંગ થાય છે તે કારણસર વ્યર્થ થશે નહીં તેવો બંધારણીય સુધારો કરીને આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં મુકવામાં આવેલ છે?
 (A) 31ક (B) 31ખ
 (C) 32 (D) 31ગ
033. ભારતના રાષ્ટ્રપતિએ કારોબારી તંત્રીય સત્તાનો ઉપયોગ બંધારણ અનુસાર કરવાનો છે અને રાષ્ટ્રપતિની સશસ્ત્ર દળોના સર્વોપરી આધિપત્યની સત્તાઓનો ઉપયોગ કાયદા દ્વારા નિયમન કરવાનો છે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે?
 (A) અનુચ્છેદ-53 (B) અનુચ્છેદ-52
 (C) અનુચ્છેદ-54 (D) અનુચ્છેદ-55
034. મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી?
 (A) હિંસાનો ત્યાગ કરવો.
 (B) વૈજ્ઞાનિક માનસ કેળવવું
 (C) મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું
 (D) આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.
035. કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થયેલી હતી?
 (A) 1964 (B) 1965
 (C) 1966 (D) 1970
036. ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે?
 (A) નામદાર રાજ્યપાલશ્રી (B) નામદાર રાષ્ટ્રપતિશ્રી
 (C) રાજ્ય (D) ઉપર પૈકી બધા જ

037. નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી?
 (A) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. (B) નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
 (C) સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિ. (D) ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ.
038. ખુલ્લા બજારમાં સંક્રિયા (Open Market Operations) કોની નીતિનો એક અંશ છે?
 (A) સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા
 (B) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
 (C) કેન્દ્ર સરકારનો નાણા વિભાગ
 (D) રાજ્ય સરકારનો નાણા વિભાગ
039. નીચે પૈકી કયુ વિધાન પ્રાદેશિક ગ્રામીણ બેંક (Regional Rural Bank) માટે સાચું નથી?
 (A) સૌપ્રથમ સ્થપાયેલી ગ્રામીણ બેંક 'પ્રથમા બેંક' છે.
 (B) ગ્રામીણ બેંકોની આંશિક માલિકી રાજ્ય સરકારની પણ હોય છે.
 (C) ગ્રામીણ બેંકોની સ્થાપના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમ્યાન થયેલ હતી.
 (D) ઉપરોક્ત બધા વિધાનો સાચા છે.
040. નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેંક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે?
 (A) રેપો રેટ (B) રિવર્સ રેપો રેટ
 (C) કેશ રિઝર્વ રેશિયો (D) રેપો અને રિવર્સ રેપો રેટ બંને
041. ભારતમાં આયોજન માટે માનવ-સંશાધન ક્ષેત્રે નવજાત શિશુ મૃત્યુ દર (Neo-Natal Mortality Rate) ઘટાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવા શિશુની કેટલી વય ધ્યાને લેવાય છે?
 (A) 0-60 દિવસ (B) 0-30 દિવસ
 (C) જન્મબાદના પ્રથમ 4 સપ્તાહ (D) જન્મબાદના પ્રથમ 6 સપ્તાહ
042. નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી-રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી?
 (A) એસ.આર. હાશીમ સમિતિ (B) લાકડાવાલા સમિતિ
 (C) વાય. કે. અલ્લુ સમિતિ (D) એન. સી. સક્સેના સમિતિ
043. ડોલેક્ષ - DOLLEX શું છે?
 (A) યુ.એસ.એ.નું એક સ્ટોક એક્સચેન્જ
 (B) ભારતનું એક સ્ટોક એક્સચેન્જ
 (C) ભારતના નાણાબજારનો એક સૂચકાંક
 (D) યુ.એસ.એ.ના નાણા બજારનો એક સૂચકાંક

044. કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે?
 (A) બિંબિસાર (B) બિંદુસાર
 (C) ચંદ્રગુપ્ત મૌર્ય (D) અશોક
045. ગુપ્તવંશનું રાજકીય ચિન્હ શું હતું?
 (A) સિંહ (B) મોર
 (C) ગરુડ (D) સાપ
046. છેલ્લા સશક્ત મુઘલ બાદશાહ ઔરંગઝેબ વિશે નીચે પૈકી કયું વિધાન સાચું નથી?
 (A) ઔરંગઝેબ ઝવાબિત-એ-આલમગીરી નામના હુકમ સંગ્રહો બનાવડાવતો
 (B) તેણે નવરોઝ તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો.
 (C) તે એક સારો વીણા વાદક હતો.
 (D) ઉપરોક્ત એકપણ નહિ.
047. તૃતીય ઍંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી?
 (A) મેંઘોરની સંધિ (B) શ્રી રંગપટ્ટનમની સંધિ
 (C) મદ્રાસની સંધિ (D) પુરંદરની સંધિ
048. યોગ્ય રીતે જોડો.
- | | ઘટના | વર્ષ |
|-------|--------------------|--------|
| (I) | ચૌરીચૌરા કાંડ | 1 1930 |
| (II) | દાંડીકૂચ | 2 1931 |
| (III) | બીજી ગોળમેજી પરિષદ | 3 1919 |
| (IV) | જલિયાવાલા બાગ ઘટના | 4 1922 |
- | | (I) | (II) | (III) | (IV) |
|-----|-----|------|-------|------|
| (A) | 4 | 2 | 1 | 3 |
| (B) | 2 | 1 | 4 | 3 |
| (C) | 4 | 1 | 2 | 3 |
| (D) | 1 | 2 | 3 | 4 |
049. રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ?
 (A) બલ્બન (B) ઇલ્તુતુમિશ
 (C) મામલુક (D) અલાઉદ્દિન ખીલજી
050. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
 (A) લોર્ડ કોર્નવોલિસ (B) લોર્ડ ઓક્લેન્ડ
 (C) લોર્ડ ડેલહાઉસી (D) લોર્ડ વિલિયમ બેન્ટિન

051. “ઈકો-માર્ક” શું છે?

- (A) અર્થતંત્રને માટે લાભદાયી યોજનાઓનું સંચાલન કરતી એક ટૂકડી
(B) પર્યાવરણ માટે નુકશાનકારક ન હોય કે ઓછી હોય તેવી ઉત્પાદિત વસ્તુઓ માટેનું પ્રમાણભૂત-ધોરણચિન્હ
(C) ઈકોલોજીને બચાવવા માટે લાભદાયી દરેક વૃક્ષ પર કરાતું ચિન્હ જે વિશ્વમાં પ્રથમ વખત ભારતમાં શરૂ થયું છે.
(D) ઉપરોક્ત એકપણ નહીં.

052. યાદી-1 અને યાદી-2 ને યોગ્ય રીતે જોડીને વિકલ્પ પસંદ કરો.

યાદી-1		યાદી-2	
(I)	યુરોપા	1	ગુરુ
(II)	સૌંદર્યનો ગ્રીક દેવતા	2	સિરસ (ceres)
(III)	સૌથી મોટો એસ્ટેરોઈડ	3	શનિ
(IV)	ટાઈટન	4	વિનસ

	(I)	(II)	(III)	(IV)
(A)	3	4	2	1
(B)	1	4	3	2
(C)	3	4	1	2
(D)	1	4	2	3

053. વાઘ માટે અનામત ક્ષેત્ર

(I)	જામ કોર્બેટ	1	ઉત્તરપ્રદેશ
(II)	રણથંભોર	2	ઉત્તરાખંડ
(III)	દુધવા	3	મિઝોરમ
(IV)	નમેરી	4	અસમ
(V)	ડંપા	5	રાજસ્થાન

	(I)	(II)	(III)	(IV)	(V)
(A)	2	5	1	4	3
(B)	5	2	4	1	3
(C)	1	2	3	4	5
(D)	2	5	1	3	4

054. નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી

- (A) હડકવા
(B) પોલિયો
(C) કુખ્ઠરોગ
(D) ગાલપચોળિયા

055. રૂસ્તમ શું છે?

- (A) માનવરહિત વાયુયાન (B) મિસાઈલ
(C) અવકાશયાન (D) ઉપગ્રહ

056. ઈ-એચ. આર્મસ્ટ્રોંગ શાના માટે વિખ્યાત છે?

- (A) ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ તરીકે
(B) તેમણે લોન્ચ વેહિકલ અંગે પ્રથમ પ્રયાસો કર્યા હતા.
(C) વાયરલેસ ટેકનોલોજીનો વિકાસ કરવા માટેનો પ્રથમ પ્રયાસ કર્યો હતો.
(D) ફ્રિક્વન્સી મોડ્યુલેશન રેડિયોના શોધક તરીકે

057. સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે?

- (A) ગુજરાત (B) ગોવા
(C) મહારાષ્ટ્ર (D) કર્ણાટક

058. DL9CG4728

- (1) DJE004728 (2) 85740087D
(3) 85740087D (4) 85740087D

- (A) આપેલ શબ્દનું દર્પણમાં પ્રતિબિંબ (1) જેવું દેખાય
(B) આપેલ શબ્દનું દર્પણમાં પ્રતિબિંબ (2) જેવું દેખાય
(C) આપેલ શબ્દનું દર્પણમાં પ્રતિબિંબ (3) જેવું દેખાય
(D) આપેલ શબ્દનું દર્પણમાં પ્રતિબિંબ (4) જેવું દેખાય

059. જો કોઈ ફૂટ-ભાષામાં PALE ને 2134 લખવામાં આવે છે અને EARTH ને 41590 લખવામાં આવે છે, તો એ જ ભાષામાં PEARL ને કયા સ્વરૂપમાં લખવામાં આવે?

- (A) 29530 (B) 24153
(C) 25413 (D) 25430

060.

5	20	6	9
4	8	15	3
9	25	7	9
22	7	8	?

ઉપર્યુક્ત ? ના સ્થાને નીચે પૈકી કઈ સંખ્યા આવે?

- (A) 7 (B) 8
(C) 9 (D) 10

061. $25 - K - 8$, $23 - I - 11$, $21 - G - 14$, $19 - E - 17$, ?
 (A) $17 - F - 19$ (B) $19 - C - 17$
 (C) $17 - C - 20$ (D) $20 - D - 17$
062. $\div$ તથા $=$, 2 તથા 3 ના સ્થાન પરસ્પર બદલવાથી નીચે પૈકી કયું સમીકરણ સાચું પડે?
 (A) $15 = 2 \div 3$ (B) $5 \div 15 = 3$
 (C) $2 = 15 \div 3$ (D) $3 = 2 \div 15$
063. $24 : 3 :: 656 : ?$
 (A) 117 (B) 97
 (C) 82 (D) 23
064. માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ, 2005 હેઠળ “માહિતીનો અધિકાર” એટલે, -
 (A) ગુપ્ત માહિતી આપવી
 (B) માહિતી આપવાનો અધિકાર
 (C) જાણવા જોગ માહિતી ભેગી કરવી.
 (D) જાહેર સત્તા તંત્રના અંકુશ હેઠળ રહેલી માહિતી પ્રાપ્ત કરવાનો અધિકાર
065. એક ક્રિકેટ ખેલાડીની 25 ઈનિંગ્સનો સરાસરી સ્કોર 40 રન છે. વધારાની એક ઈનિંગ્સ રમવાના કારણે તેના રનની સરેરાશ 3 રન વધી જાય છે. તો છેલ્લી વધારાની ઈનિંગ્સમાં કેટલા રન તેણે કર્યા હશે?
 (A) 82 (B) 98
 (C) 118 (D) 43
066. માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ, 2005 હેઠળ “જાહેર સત્તામંડળોની જવાબદારીઓ” એટલે
 (1) જાહેર સત્તા મંડળે તમામ રેકૉર્ડ માહિતી મેળવવાના અધિકારને સુવિધાપૂર્ણ બનાવે તેવી રીતે અને તેવા સ્વરૂપમાં જાળવવા.
 (2) જેને કોમ્પ્યુટરાઈઝડ કરવા ઉચિત હોય તેને વાજબી સમયમાં કોમ્પ્યુટરાઈઝડ કરાવવા.
 (3) જાહેર ફરજો બજાવવી.
 (4) સત્તા તંત્રએ સત્તા ભોગવવી.
 (A) 1 અને 3 (B) 1 અને 2
 (C) 2 અને 3 (D) 2 અને 4

067. વન મહોત્સવ 2016 અંતર્ગત જાહેર કરાયેલા નવા વનોમાં “શહિદ વન” ક્યાં બનાવવામાં આવશે?
- (A) બારડોલી (B) બાલાચડી
(C) ભૂચરમોરી (D) વેરાખડી
068. માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપો સંબંધી માહિતી કોની મંજૂરી મેળવીને પૂરી પાડવાની હોય છે?
- (A) માનવ અધિકાર પંચ (B) રાજ્ય માહિતી પંચ
(C) નામદાર રાજ્યપાલશ્રી (D) કેન્દ્રિય માહિતી પંચ
069. માહિતી (મેળવવાના) અધિકાર, અધિનિયમ, 2005 હેઠળ જો માંગવામાં આવેલ માહિતી અન્ય જાહેર સત્તામંડળ સાથે સંકળાયેલ હોય તો, જાહેર માહિતી અધિકારીએ તે સત્તામંડળને કેટલા દિવસમાં તે બાબત તબદીલ કરવી જોઈએ?
- (A) 5 (B) 7
(C) 10 (D) 15
070. માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ, 2005 હેઠળ માહિતી માંગનારે કઈ ભાષામાં લેખિતમાં અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ મારફતે જરૂરી ફી સાથે અરજી કરવી જોઈએ?
- (A) અંગ્રેજી
(B) હિન્દી
(C) જે તે વિસ્તારની રાજભાષા
(D) અંગ્રેજી અથવા હિન્દી અથવા જે તે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય તેની રાજ્યભાષા
071. માહિતી (મેળવવાનો) અધિકાર, અધિનિયમ 2005 કેન્દ્રિય/રાજ્ય માહિતી પંચને ક્યારે દંડલક્ષી જોગવાઈઓનો અધિકાર આપે છે?
- (1) માહિતી મેળવવાની અરજીનો સ્વીકારવાનો ઈનકાર કરે ત્યારે
(2) માંગેલ માહિતી નક્કી કરેલ સમયમર્યાદામાં પૂરી ન પાડે ત્યારે
(3) બીજા સત્તા તંત્રની માહિતી પૂરી પાડે ત્યારે
(4) માંગેલ માહિતીથી વધુ માહિતી આપે ત્યારે
- (A) (1) અને (2) (B) (1) અને (4)
(C) (2) અને (4) (D) (3) અને (4)
072. માહિતી (મેળવવાનો) અધિકાર, અધિનિયમ, 2005 કયા સંગઠનોને લાગુ પડાયો નથી?
- (1) રાજ્ય સરકાર હસ્તકના મહેસૂલ વિભાગોને
(2) પોલિસતંત્રને
(3) રીસર્ચ એન્ડ એનાલીટીક્સ વીંગને
(4) સેન્ટ્રલ રીઝર્વ પોલિસ ફોર્સને
- (A) (1) અને (4) (B) (3) અને (4)
(C) (2) અને (4) (D) (1) અને (3)

073. નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે?
 (A) ગુણીભૂત (B) ગૂણીભૂત
 (C) ગુણિભૂત (D) ગુણીભુત
074. સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી?
 (A) સૂરજ (B) અવાજ
 (C) દેવ (D) ધ્વનિ
075. તૂમડીના કાંકરા-રૂઢિ પ્રયોગનો સાચો અર્થ કયો છે?
 (A) વગર મહેનતે વિઘ્ન ટળવું (B) પડતી આવવી
 (C) તંગી હોવી (D) સમજી ન શકાય તેવી વાત
076. નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે?
 (A) ચૂસણીયુ (B) સૂસણિયું
 (C) ચુસણિયું (D) સુસણિયુ
077. “ઊને પાણીએ ઘર ન બળે” એ કહેવતનો સાચો અર્થ કયો છે?
 (A) કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
 (B) મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
 (C) ધીરજથી કામ સારું થાય.
 (D) થોડું થોડું કરતાં મોટું કામ થાય.
078. “નાકની દાંડી સામે આંખો રાખવી”- તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે?
 (A) પ્રમાણિક રહેવું (B) સીધે રસ્તે જવું
 (C) સામે મોંએ જવું (D) સીધો કે ધોરી માર્ગ
079. “ગળામાં જોતરું ઘાલવું” તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે?
 (A) વિશ્વાસઘાત કરવો (B) પીડા વળગાડવી, જંજાળમાં પડવું
 (C) સમ ખાવા (D) ગળું રૂંધાવું
080. Fill in the blanks by using the most suitable indefinite pronoun.
 Ashok has knowledge but he just makes show that he knows everything.
 (A) little (B) a little
 (C) the little (D) few
081. Fill in the blanks using the verb given in the bracket. Select the appropriate option.
 The mother often her daughter in the kitchen. (get + work)
 (A) got work (B) get work
 (C) get to works (D) got to works

- 082.** Fill in the blanks by selecting the most appropriate option given below.
 “The report the destination by now.” (must + reach)
 (A) must have reached (B) must have been reached
 (C) must reached (D) must has been reached
- 083.** Add a question tag, by selecting the most appropriate option given below.
 Little milk is in the cup,?
 (A) is it (B) is not it
 (C) does not it (D) does it
- 084.** Complete the sentence using the words given in the bracket, and select the one of the options.
 You are requested (keep, silence)
 (A) to kept silence (B) to keep silence
 (C) to keep the silence (D) None of the above
- 085.** Rewrite the following sentence by replacing the underlined parts by the appropriate group of words given in the following options.
 “One butterfly swooped down on his knee.”
 (A) tumbled down (B) flew down suddenly
 (C) fell down (D) fall down
- 086.** Which option is incorrect?
 Verb Adjective
 (A) Decide – Deciding
 (B) Desire – Desirable
 (C) Ignore – Ignorance
 (D) Perform – Performing
- 087.** નીચે દર્શાવેલ રમતો પૈકી કઈ રમત વર્ષ 1900 અને 1904 ની ઓલિમ્પિકમાં હતી અને ત્યારબાદ ફરીથી તે વર્ષ 2016 માં રીયો ઓલિમ્પિકમાં સ્થાન પામેલ છે?
 (A) બીચ વોલીબોલ (B) ગોલ્ફ
 (C) સાર્કલ્વીંગ (D) ટેઈકવોન્ડો
- 088.** રમતગમતના ક્ષેત્રમાં કોચને આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે?
 (A) 1985 (B) 1990
 (C) 1992 (D) 1987

089. વર્ષ 2016 નો રાજીવ રત્ન ખેલ એવોર્ડ જીતુ રાયને કઈ રમતમાં મળેલ છે?
 (A) બેડમિન્ટન (B) જીમ્નેસ્ટીક્સ
 (C) શૂટીંગ (D) કુસ્તી
090. ધી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સનું વડુ મથક કયા દેશમાં આવેલ છે?
 (A) રશિયા (B) સ્વીટઝર્લેન્ડ
 (C) ચીન (D) જાપાન
091. એશિયન ગેઈમ્સ, 2014 માં અભિષેક વર્માને સુવર્ણચંદ્રક શામાં મળેલ હતો?
 (A) પિસ્તોલ શૂટીંગ (B) કુસ્તી
 (C) તીરંદાજી (D) તરણસ્પર્ધા
092. વર્ષ 2016 માં અજ્ઞરબૈઝાનમાં આયોજિત જુનિયર વર્લ્ડકપ શૂટિંગમાં કયા ગુજરાતી ખેલાડીએ સુવર્ણચંદ્રક મેળવેલ છે?
 (A) અંશુલ કોઠારી (B) કિરણ પરમાર
 (C) સ્મિત શર્મા (D) ઋષિરાજ બારોટ
093. રિયો ઓલિમ્પિક, 2016 માં ભાગ લીધેલ નીચેના ભારતના ખેલાડીઓ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- | ખેલાડીનું નામ | રમતનું નામ |
|--------------------|---------------|
| (I) દિપીકા કુમારી | 1 જુડો |
| (II) અવતાર સીંઘ | 2 કુસ્તી |
| (III) સાજન પ્રકાશ | 3 તીરંદાજી |
| (IV) યોગેશ્વર દત્ત | 4 તરણ સ્પર્ધા |
- | | (I) | (II) | (III) | (IV) |
|-----|-----|------|-------|------|
| (A) | 4 | 2 | 3 | 1 |
| (B) | 3 | 1 | 2 | 4 |
| (C) | 3 | 1 | 4 | 2 |
| (D) | 4 | 3 | 1 | 2 |
094. કિરણ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે?
 (A) કબડ્ડી (B) ટેબલ ટેનિસ
 (C) સ્કવોશ (D) સ્નૂકર
095. સ્વૈની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક કયા બે ડેમ વચ્ચે હશે?
 (A) લીમડી ભોગાવોથી રાયડી ડેમ (B) મચ્છુ-2 થી સાની ડેમ
 (C) ધોળીધજા ડેમથી વેણુ ડેમ (D) લીમડી ભોગાવોથી હિરણ-2

096. હાલમાં ચર્ચામાં રહેલ “ભારત સ્ટેજ” શું છે?
- (A) ભારતની સંસ્કૃતિને વિશ્વમાં પ્રસારિત કરવા માટે શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ
 (B) સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધારવા માટેની ઝુંબેશ
 (C) યુ.એન.માં સ્થાયી સભ્યપદ માટે ભારતે રજૂ કરેલ એક દસ્તાવેજનું શિર્ષક
 (D) ભારત સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે લાગુ કરવામાં આવેલ ઉત્સર્જન માનક
097. તાજેતરમાં ચર્ચામાં રહેલ કાવેરી નદીના જળ વિવાદ સમાધાન માટે કયા કાયદા હેઠળ ટ્રીબ્યુનલની રચના કરવામાં આવી હતી?
- (A) આંતર રાજ્ય નદી જળ-વિવાદ અધિનિયમ, 1956
 (B) આંતર રાજ્ય નદી જળ-વિવાદ 1955
 (C) કાવેરી નદી જળ વિવાદ ટ્રીબ્યુનલ અધિનિયમ, 1956
 (D) ઉપર પૈકી એકપણ નહીં.
098. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 2016 ના વિજેતા મનોજકુમારનું સાચું નામ શું છે?
- (A) રાજવકુમાર ગોસ્વામી (B) માનવકુમાર ગોસ્વામી
 (C) હરિકૃષ્ણગીરી ગોસ્વામી (D) ઓમકિશોર ગોસ્વામી
099. વર્ષ 2016માં બેજવાડા વિલ્સનને કયા કાર્ય માટે રેમન મેગ્સેસે પુરસ્કાર આપવામાં આવેલ છે?
- (A) સમુદાય નેતૃત્વ માટે
 (B) માથે મેલું ઉપાડવાની પ્રથા નાબૂદ કરવા માટેના પ્રયાસો માટે
 (C) બાળમજૂરી સામે લડત ચલાવવા માટે
 (D) આંતરરાષ્ટ્રીય શાંતિ અંગે પ્રયાસો કરવા માટે
100. વર્ષ 2016માં શરૂ કરાયેલ ‘ટાઈગર એક્સપ્રેસ’ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે?
- (A) દિલ્હીથી બેંગ્લોર (B) દિલ્હીથી મુંબઈ
 (C) દિલ્હીથી કલકત્તા (D) દિલ્હીથી જબલપુર